

પ્ર. ૧ નીચેનાં નાણાંકીય ખ્યાલો ઊંડાણપૂર્વક સ્પષ્ટ કરો.

(૧) નાણાંકીય મિલકતો

(૨) નાણાંકીય પરત-દર

(૩) નાણાંકીય સાધનો

(૧૮)

અથવા

પ્ર. ૧

(અ) વિવિધ પ્રકારનાં નાણાંકીય બજારો ચર્ચો.

(બ) “નાણાંત્ર બચત કરનાર અને રોકાણકાર અને ઉત્તેજકો માટે ઝડપી આર્થિક વિકાસ સંદર્ભે મધ્યસ્થી બને છે.” નાણાંકીય બજારો સંદર્ભે તેનાં કાર્યો ઉપર ટીકા કરો.

(૧૦)

(૦૮)

પ્ર. ૨ નીચેના પૈકી કોઈપણ બે ઉપર વિસ્તૃત નોંધ લખો.

(૧) ઓન-લાઈન વેપાર

(૨) ભારતમાં શેરબજારો

(૩) સૈબીની ભૂમિકા અને સત્તા

(૪) વિવિધ જામીનગીરીઓ અને તેના લક્ષણો

(૧૭)

પ્ર. ૩

(અ) આર્થિક વિશ્લેષણ અને ઔદ્યોગિક વિશ્લેષણ યોગ્ય ઉદાહરણો સહિત ચર્ચો.

(બ) આર. જે. શેઠ એક્સવાયઝેડ કેમિકલ્સમાં રોકાણ કરે છે. કંપનીનો મૂડીકરણ દર ૧૫% અને પ્રવર્તમાન ડિવિડન્ડ દર રૂ. ૨/- પ્રતિ શેર છે. કંપનીના ઈક્વિટી શેરનું મૂલ્ય ગણો.

(૧૫)

(૦૩)

(૧) જો કંપની ધીમે-ધીમે વાર્ષિક વિકાસ દર -૫% (નકારાત્મક ૫%) ડિવિડન્ડના સંદર્ભે ફૂલતમાં જઈ રહી છે.

(૨) જો કંપનીનો વિકાસ થતો નથી પરંતુ ડિવિડન્ડ જળવાઈ રહ્યું છે.

(૩) જો કંપનીનો સરેરાશ સતત વાર્ષિક વિકાસ દર ૭% છે.

અથવા

(૧) ધી ઓનેસ્ટ લીમિટેડની આવક અને ડિવિડન્ડ ૧૨%નાં દરે મેળવે છે. આ વિકાસ દર ૪ વર્ષનો સતત અંદાજીત છે. ત્યારબાદ આગામી ૪ વર્ષ માટે આ વિકાસ દર ૮% સુધી જશે. આ ઉપરાંત વિકાસ દર ૫% કાયમી ધારવામાં આવે છે. જો અંતિમ ડિવિડન્ડ રૂ. ૫.૫૦ અને રોકાણકારોનો જરૂરી ધી ઓનેસ્ટ લીમિટેડના શેર ઉપર વળતરનો દર ૧૪% હોય, તો કંપનીના ઈક્વિટી શેરનું પ્રતિ શેર બજાર મૂલ્ય કેટલું હોવું જોઈએ?

(૧૮)

(૨) નીચેનાં બે રોકાણ વિકલ્પોને ધ્યાનમાં લો.

	પ્રેક્કરન્સ શેર	ડિબેન્ચર
પરિપક્વતાનો સમય	---	૭ વર્ષ
વાર્ષિક ડિવિડન્ડ / વ્યાજ	રૂ. ૧૨/-	રૂ. ૧૫/-
જરૂરી વળતર દર	૧૫%	૨૦%
સમાન મૂલ્ય	રૂ. ૧૦૦/-	રૂ. ૧૦૦/-

- પ્રેક્કરન્સ શેર અને ડિબેન્ચરના આંતરિક મૂલ્યોની ગણતરી કરો.

- ધારો કે પ્રેક્કરન્સ શેરનો જરૂરી વળતર દર ૧૩% અને ડિબેન્ચરનો જરૂરી વળતર દર ૧૬% જેટલો ઘટી જાય તો બંને જામીનગીરીઓનાં આંતરિક મૂલ્યની ગણતરી કરો.

- પ્રેક્કરન્સ શેર અને ડિબેન્ચરના આંતરિક મૂલ્યોમાં બદલાવની ટકાવારીની ગણતરી કરો.

(૩) તકનીકી વિશ્લેષણ અને મૂળભૂત વિશ્લેષણ વચ્ચેનો તફાવત લખો.